

તાન્કાલિક પ્રકાશન માટે

બ્રેમ્પટન માટે વૃદ્ધિ, વિકાસ સંબંધિત વિષયો પર પ્રાંતીય આગેવાનો સાથે બેઠક

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 14, 2019) – સીટી ઓફ બ્રેમ્પટનનું એક પ્રતિનિધિ મંડળ ટ્રાન્ઝિટ (પરિવહન), આરોગ્ય સંભાળ, સામુદાયિક સુરક્ષા, પર્યાવરણ અને આવાસીય બાબતોના ક્ષેત્રોમાં [વૃદ્ધિ માટે મહત્વની અગ્રતાઓ](#) સંબંધિત ચર્ચા કરવા ઓટાવામાં પ્રોવિન્સિયલ મિનિસ્ટ્રી લીડર્સ (પ્રાંતીય મંત્રાલયના આગેવાનો) સાથે મળવા તૈયાર થયું છે. મેયર પેટ્રિક બ્રાઉનની (Patrick Brown) આગેવાનીમાં, શહેરના અધિકારીઓ ભંડોળ અને સહયોગ વધારવા માટેની તરફેણ કરવા ઓગસ્ટ 18-21 દરમિયાન એસોસિએશન ઓફ મ્યુનિસિપાલિટીસ ઓફ ઓન્ટેરિયો (AMO) ની વાર્ષિક કોન્ફરન્સમાં હાજર રહેશે.

માળખાગત સગવડો, નગરપાલિકાની અને આવાસીય બાબતો, પરિવહન મંત્રીઓ (મિનિસ્ટર્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મ્યુનિસિપલ અફેર્સ એન્ડ હાઉસિંગ, ટ્રાન્સપોર્ટેશન) અને અન્ય મંત્રાલયોના અધિકારીઓ (અધર મિનિસ્ટ્રીસ ઓફિસિયલ્સ), તેમજ NDP, લિબરલ અને ગ્રીન પાર્ટીઓના પક્ષ આગેવાનો સાથે બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે.

શહેરના મુખ્ય પ્રશ્નોમાં આ મુદ્દાઓનો સમાવેશ થાય છે:

- બ્રેમ્પટન ટ્રાન્ઝિટને વ્યાજબી ભંડોળ ફાળવણી, અને મુખ્ય રસ્તા પર લાઈટ રેઈલ ટ્રાન્ઝિટ માટે \$1.7 અબજ
- દ્વિ-માર્ગીય, આખા દિવસની GO સેવાને સહાયરૂપ થવા પ્રોજેક્ટ્સ ઝડપી બનાવવા
- બ્રેમ્પટન આરોગ્ય સંભાળ, અને મહત્વના આરોગ્ય સંભાળ પ્રોજેક્ટ્સના વિકાસ માટે વ્યાજબી ભંડોળ
- મેટ્રોલિક્સની માલિકીની મિલકતને જાહેર સ્થળમાં પરિવર્તિત કરવાની યોજનાઓ માટે સહાય
- સમુદાય સુરક્ષા માટે સાકલ્યવાદી અભિગમને ટેકો આપવા સાધનો અને માહિતી વહેંચણી
- ડાઉનટાઉનમાં પૂર શમન અને રિવરવોક પ્રોજેક્ટ આગળ વધારવા ભંડોળ
- પ્રોજેક્ટ્સ માટે ભંડોળ અને નિયમનકારી સહાયતા અને આબોહવા ફેરફાર શમન અને અનુકૂલનને ટેકો આપવાની પહેલ
- બિલ 108 માં નિર્ધારિત નવા નિયમનોમાં ફેરફારો જે ઉદ્યાનો, સામુદાયિક કેન્દ્રો અને પુસ્તકાલયો જેવી સગવડો માટે વિકાસની આવક ઊભી કરવા શહેરની ક્ષમતાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે
- બ્રેમ્પટન માટે રીજીયન ઓફ પીલ કાઉન્સિલમાં નિષ્પક્ષ પ્રતિનિધિત્વની તરફેણમાં પ્રાદેશિક શાસન માળખામાં પૂર્વવર્તી ફેરફાર

બ્રેમ્પટનની વિકાસ અગ્રતાઓ પર વધુ માહિતી માટે જુઓ, [સીટીની વેબસાઈટ](#).

અવતરણ (ક્વોટ):

“આપણને બ્રેમ્પટનની અગ્રતાઓ અને દૃષ્ટિકોણને પહોંચી વળવા પ્રોવિન્સનો ટેકો અને ભાગીદારીની જરૂર છે. આપણે સંબંધો બનાવવા, ઉન્નત ટ્રાન્ઝિટ, સમુદાય સુરક્ષા, નવીન શોધ અને પર્યાવરણલક્ષી પહેલો માટે મુદ્દાઓની ચર્ચા કરવા અને મહત્વની અગ્રતાઓ આગળ ધપાવવા આશાવાદી છીએ.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને ત્યાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca